


શ્લોક : ૫

ગંગાજી અને લક્ષ્મીજી કરતાંય શ્રેષ્ઠ

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા
સમાગમનોઽ ભવત્ સકલસિદ્ધિદા સેવતામ્ ।
તયા સદ્શામિયાત્ કમલજા સપત્નીવ યત્
હરિપ્રિયકલિન્દયા મનસિ મૈ સદા સ્થીયતામ્ ॥૫॥



યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા । સમાગમનોઽ ભવત્ સકલસિદ્ધિદા સેવતામ્ ॥
તયા સદ્શામિયાત્ કમલજા સપત્નીવ યત્ । હરિ પ્રિયકલિન્દયા મનસિ મૈ સદા સ્થીયતામ્ ॥૫॥

जिन श्रीयमुनाजी के समागम से भगवत्चरण से प्रकट हुई श्री गंगाजी श्री भगवान को प्रिय हुई, उन श्रीयमुनाजी की समानता भला कौन प्राप्त कर सकता है ? हैं ! यदि कुछ समानता कर सकती है तो वह कुछ न्यूनता के साथ श्री लक्ष्मीजी ही, ऐसी सर्वोपरि तथा भगवत्पत्नी के क्लेशों को नाश करने वाली श्री यमुनाजी में मन में निरन्तर वास करें ॥५॥

શબ્દાર્થ : યયા = જેની સાથે, ચરણ પદ્મજા = ચરણ હમળમાંથી ઉત્પન્ન થયેલા, ગંગાજી, મુરરિપોઃ = મુર નામના દૈત્યના રિપુ એટલે કે શત્રુ, શ્રી કૃષ્ણ, પ્રિયંભાવુકા = પ્રિય પાત્ર બઠ્યા, સમાગમનતઃ = સમાગમથી, મેળાપથી, આભાવત્ = થયા, સકલસિદ્ધિદા = સર્વસિદ્ધિ આપનારા, સેવતામ્ = સેવા કરનારા, ભક્તોને, તયા = તેની સાથે - શ્રીયમુનાજીની સાથે, સદ્શાતામ્ = સમાજપલાને, ઈયાત્ = પાત્રી શહે, કમલજા = હમળમાંથી ઉત્પન્ન થયેલા, લક્ષ્મીજી, સપત્નીવ = સપત્ની+ ઈવ = સપત્ની (શોહ્ય) ની જેમ, સમાજ સૌભાગ્યવાળા, હરિપ્રિય = હરિને પ્રિય એવા, કલિન્દયા = યમુનાજી વડે, મનસિ = મનમાં, મૈ = મારા, સદા = હંમેશા, સ્થીયતામ્ = રહો, વાસ કરો.

ભાવાર્થ : શ્રી કૃષ્ણના ચરણહમળમાંથી ઉત્પન્ન થયેલા ગંગાજી, યમુનાજીના સમાગમ પછી જ પ્રભુના પ્રિય પાત્ર બઠ્યા અને પોતાની સેવા કરનારા સર્વ જીવોને સર્વ પ્રકારની સેદ્ધિઓ આપનારા થયા. પરંતુ યમુનાજી સાથે સૌભાગ્ય સ્પર્ધા કરી શકે અને યમુનાજીની સાથે પોતાનું સરખામણુ બતાવી શકે તેવું લક્ષ્મીજી વિના બીજું કોણ હોઈ શકે? હરિને પ્રિય એવા યમુનાજી મારા મનમાં હંમેશા રહો.

શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાહનવી ઉત્પન્ન થયાં સત્સંગ પાઠ્યા આપનું તે સિદ્ધી દાયક થઈ ગયા એવું માહાત્મ્ય છે આપનું સરખામણી હોઈ શું કરે સમ હક્ક માં આવી શકે સાગરવૃતા એકજ ખરે એવા પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો વંદન કરું શ્રી યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો॥૫॥